

EVA ELITE વુમન્સ સેવિંગ્સ એકાઉન્ટ - શુલ્કનું સમયપત્રક

(૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)



ખાતા અને બેલેન્સની જાળવણી	
AMB	શૂન્ય
કુલ સંબંધ મૂલ્ય*	રૂ. ૨,૫૦,૦૦૦
બિન-જાળવણી શુલ્ક	શૂન્ય
ચેક લુક (૨૫ લીફની PAP ચેક લુક)	મફત

ઉધરાણી	
સ્થાનિક ચેક ક્રિયાર્થિ	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક ક્રેડિટાનું શુલ્ક	મફત
બેંક સિવાયના અન્ય સ્થળોએ અન્ય બેંક ચેક ક્રેડિટાનું શુલ્ક	મફત
RTGS /NEFT /IMPS ઇનવર્ડ	મફત

ચુકવણી	
બેંકની શાખાએ મફત ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	મફત
બેંકની શાખા સિવાયના સ્થળોએ ડિમાન્ડ ડ્રાફ્ટ	મફત
PAP ચેક વડે ચુકવણી	મફત
શાખામાં RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઇન)	મફત
IMPS આઉટવર્ડ (મફત ઓનલાઇન) ટિપ્સ ટીક મર્યાદા ૨,૦૦,૦૦૦/-	૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ. ૨.૫/-, રૂ. ૫૦૦૦૦૦ - રૂ. ૧ લાખ: રૂ. ૫/-, રૂ. ૧ લાખથી વધુ: રૂ. ૭.૫/-

રોકડ શુલ્ક	
રહેણાં સ્થળે રોકડ જમા	શૂન્ય
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	રૂ. ૫/૧૦૦૦
બિન-રહેણાં સ્થળે રોકડ જમા	શૂન્ય
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	રૂ. ૫/૧૦૦૦
રહેણાં સ્થળે રોકડ ઉપાડ	મફત
મેટ્રો સ્થળે (અન્ય એટીએમ) ડેબિટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડના વ્યવહારો	૩
નોન-મેટ્રો સ્થળે (અન્ય એટીએમ) ડેબિટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડના વ્યવહારો	૫
એટીએમ ઉપાડની મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ નાણાકીય વ્યવહાર રૂ. ૨૩, પ્રતિ બિન-નાણાકીય વ્યવહાર રૂ. ૧૨
બિન-રહેણાં સ્થળે રોકડ ઉપાડ	મફત
નોન-ઇન્ડિયન એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નક્કર	૧૦/- પ્રતિ ટ્રાન્ઝેક્શન
મેટ્રો/શહેરી સ્થળે ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના મફત વ્યવહારો	ક્લેઈ મર્યાદા નથી
અર્ધ શહેરી/ગ્રામીણ સ્થળે ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના મફત વ્યવહારો	ક્લેઈ મર્યાદા નથી
એટીએમ ઉપાડની મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	લાગુ પડતું નથી
ભારતની બહાર રોકડ ઉપાડ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	મફત
ભારતની બહાર બેલેન્સની પૂછપરછ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	મફત

અન્ય શુલ્ક	
માસ્ટરકાર્ડ/વિઝા સિમેયર/પ્લેટિનમ ડેબિટ કાર્ડ	જારી - મફત
	વાર્ષિક ફી અને ફરીથી જારી કરવાના શુલ્ક, કાર્ડના પ્રકાર મુજબ લાગુ
કાર્ડ વડે વ્યવહારની સ્થિતિની પુનઃપ્રાપ્તિના શુલ્ક (ખોટા ઘવાઓ માટે)	મફત
સ્લેપ પેમેન્ટ સિંગલ ચેક	મફત
સ્લેપ પેમેન્ટ સિરીઝ	મફત
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્નના શુલ્ક	પ્રતિ ચેક રૂ. ૭૫
ટેકનિકલ કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્નના શુલ્ક	શૂન્ય
નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્નના શુલ્ક	૨ ચેક સુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦/- થી
ટેકનિકલ કારણોસર ઇનવર્ડ/આઉટવર્ડ ચેક રીઝર્નના શુલ્ક	શૂન્ય
સ્થાયી સૂચનાઓ સેટ અપ / સુધારા	મફત
સ્થાયી સૂચનાઓ બિઝનેસતા (રીઝર્વ)	પ્રતિ રિઝર્વ રૂ. ૧૫૦/-
નાણાકીય કારણોસર ECS/NACH રિઝર્વ	પ્રતિ રિઝર્વ રૂ. ૨૦૦/-
SMS ચેતવણીઓ (ડેબિટ અને ક્રેડિટ વ્યવહારો)	પ્રતિ મહિને ૧૦ મફત જામજ. ત્યારબાદ, પ્રતિ જામજ ૩૦ પૈસા
ફોરેન એક્સચેન્જ માર્ક-અપધ	૩.૫%

EVA ELITE વુમન્સ સેવિંગ્સ એકાઉન્ટ - શુલ્કનું સમયપત્રક (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)



પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
નેલેન્સ પ્રમાણપત્ર શાખા (ઓનલાઇન મફત)	મફત
પાછલા વર્ષની નેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ (ઓનલાઇન મફત)	મફત
પાસબુક જારી કરવી	મફત
ડ્રુપ્સિકેટ પાસબુક જારી કરવી	મફત
સહીની ચક્ષસણી પ્રમાણપત્ર/ફોટો પ્રમાણિત/સરનામાની પુષ્ટિ (જો બેંકમાં સહી અપડેટ કરવામાં આવી હોય તો જ)	મફત
ડ્રુપ્સિકેટ TDS પ્રમાણપત્ર	મફત
ડ્રુપ્સિકેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઇમેઇલ પર)	મફત
DD/PO પુનઃમાન્યીકરણ/રદીકરણ	મફત
ખાતું ખોલવાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ કરતા પહેલા ગ્રાહકની વિનંતી પર બંધ કરવામાં આવે તો ખાતું બંધ કરવાના શુલ્ક	મફત
ખાતું નિષ્ક્રિય રહેવા પર શુલ્ક	શૂન્ય

એરરેપ બેંકિંગ**	
કોલ પર ચેક પિકઅપ (દર મહિને)	મફત
ચેક પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	મફત
કેશ પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦/-
રૂ. ૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦	રૂ. ૫૦૦૦/-
રૂ. ૫,૦૦,૦૦૦ થી ૧૦,૦૦,૦૦૦	રૂ. ૧૦૦૦૦/-
૧૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
કોલ પર કેશ પિકઅપ (દરેક વખતે શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦૦ સુધી	મફત
રૂ. ૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦	મફત
રૂ. ૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	મફત
રૂ. ૧૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦૦	મફત
રૂ. ૨૦૦૦૦૦ થી વધુ	મફત

વ્યવહારોની સંખ્યા	
ગ્રાહક દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારોનું એકત્રીકરણ જેમાં શામેલ છે:	મફત
રોકડ/ચેક//DSB/DD (ઓનલાઇન અને એટીએમ વહેંચેલ વ્યવહાર સિવાય)	લાગુ પડતું નથી
મુક્ત મર્યાદાથી વધુ પર શુલ્ક	લાગુ પડતું નથી

*સમાન કેરટમર આઈસી હેઠળ સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સડ ડિપોઝિટમાં કુલ નેલેન્સ કુલ સંબંધ મૂલ્ય (TRV) ગણાશે.

**વિનંતી પર ફક્ત પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ PAP-પેમેન્ટ એટ પર NA: લાગુ પડતું નથી જ્યારે સેવિંગ્સ એકાઉન્ટ. કા વધારાનો રહેશે

^ધભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા દરેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કા) વસૂલવામાં આવશે. આ CASA ખાતા હેઠળ જારી કરાયેલા તમામ ડેબિટ કાર્ડ્સ માટે લાગુ પડે છે, સિવાય કે Elite (માસ્ટર્કાર્ડ વર્લ્ડ) અને Niyo (વિઝા પ્લેટિનમ). કૃપા કરીને નોંધ લો કે બેંકની વિવેકલુક્ષિના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.